

ગમે તેટલું અંધારું કેમ ન છવાય, ભારત મૂળ સ્વભાવ છોડતો નથી. : વડાપ્રધાન મોદી

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'આઝાદી કે અમૃત મહોત્સવ સ્વર્ણમ ભારત કી ઓર' કાર્યક્રમની શરૂઆત કરી. આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારા અને રાષ્ટ્રના સપના એક જ છે. એક નવી સવાર થવાની છે. જ્યારે સંકલ્પ સાથે સાધના જોડાઈ તો કાળખંડ બનવું નિશ્ચિત છે. તેમણે કહ્યું કે ગમે તેટલું



રાષ્ટ્રનું અસ્તિત્વ છે અને રાષ્ટ્રથી જ આપણું અસ્તિત્વ છે. આ ભાવ, આ

બોધ નવા ભારતના નિર્માણમાં આપણે ભારતવાસીઓની સૌથી મોટી તાકાત બની રહ્યો છે. આજે દેશ જે કંઈ કરી રહ્યો છે તેમાં બધાના પ્રયાસ સામેલ છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે અમે એક એવી વ્યવસ્થા બનાવી રહ્યા છીએ જેમા ભેદભાવની કોઈ જગ્યા ન હોય. એક એવો સમાજ બનાવી રહ્યા છીએ જે સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર મજબૂત થી ઊભો હોય. આપણે

એક એવું ભારત ઉભરાતા જોઈ રહ્યા છીએ, જેની સોય અને અપ્રોચ નવા છે અને જેના નિર્ણય પ્રગતિશીલ છે. તેમણે કહ્યું કે દુનિયા જ્યારે અંધકારના દોરમાં હતી, મહિલાઓને લઈને જૂની સોયમાં જકડાયેલી હતી, ત્યારે ભારત માતૃશક્તિની પૂજા, દેવીના સ્વરૂપમાં કરતું હતું. આપણા ત્યાં ગાર્ગી, મૈત્રેયી, અનસૂયા, અરૂંધતિ, અને મદાલસા જેવી વિદુષિઓ સમાજને શાન આપતી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે મુશ્કેલીઓથી ભરેલા મધ્યકાળમાં પણ આ દેશમાં પત્તાપાય અને મીરાબાઈ જેવી મહાન નારીઓ થઈ. અમૃત મહોત્સવમાં દેશ જે સ્વાધીનતા સંગ્રામના ઈતિહાસને યાદ કરી રહ્યો છે તેમા પણ કેટલીય મહિલાઓએ પોતાના બલિદાન આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે કિતુરની રાણી ચેનમ્મા, મતંગિની ડાજરા, રાણી લક્ષ્મીબાઈ, વીરંગના જલકારી બાઈથી લઈને

સામાજિક ક્ષેત્રમાં અહિલ્યાબાઈ હોલ્કર તથા સાવિત્રીબાઈ ફૂલે સુધી, આ દેવીઓએ ભારતની ઓળખ બનાવી રાખી. આજે દેશ લાખો સ્વાધિનતા સેનાનીઓની સાથે નારી શક્તિના યોગદાનને યાદ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે અમૃતકાળનો આ સમય આપણા શાન, શોધ અને ઈનોવેશનનો સમય છે. આપણે એક એવું ભારત બનાવવાનું છે જેના મૂળિયા પ્રાચીન પરંપરાઓ અને વારસા

સાથે જોડાયેલા હશે અને જેના વિસ્તાર આધુનિકતાના આકાશમાં અનંત સુધી થશે. તેમણે કહ્યું કે દેશના લોકતંત્રમાં પણ મહિલાઓની ભાગીદારી વધી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં પુરુષો કરતા વધુ મહિલાઓએ મતદાન કર્યું. આજે દેશની સરકારમાં મોટી મોટી જવાબદારીઓ મહિલા મંત્રીઓ સંભાળી રહ્યા છે. હવે સમાજ આ બદલાવનું નેતૃત્વ પોતે કરી રહ્યો છે.

ગહલોતે વડાપ્રધાનને પત્ર લખ્યો

દેશમાં ભાઈચારો, શાંતિ અને સૌહાર્દ મજબૂત બને, તેની પણ જરૂર છે

જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે દેશમાં હિંસા અને તણાવનું વાતાવરણ છે અને તેને મુક્ત કરવું જોઈએ. તેમણે આ વાત એવા સમયે કહી જ્યારે પીએમ મોદીએ પણ બ્રહ્મા કુમારી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન રાજસ્થાનના સીએમએ ગુરુવારે સવારે કહ્યું કે પીએમ મોદી જે સંદેશ કાર્યક્રમમાં આપશે તે દરેકે ખૂણે ખૂણે પહોંચશે.



મેળવવા માંગીએ છીએ. ગેહલોતે કહ્યું કે હું સમજું છું કે સત્યના માર્ગે ચાલીને જ અહિંસાથી સમાજ અને દેશ આગળ વધી શકે છે, જ્યાં શાંતિ અને વિકાસ હશે.



બ્રહ્મા કુમારીઓના પ્રયાસો પણ છે. તેમણે કહ્યું કે આપણી પ્રગતિ રાષ્ટ્રની પ્રગતિમાં સમાયેલી છે. રાષ્ટ્ર આપણી અસ્તિત્વ ધરાવે છે, અને આપણે રાષ્ટ્રમાંથી જ અસ્તિત્વમાં છીએ. આ લાગણી, આ અનુભૂતિ નવા ભારતના નિર્માણમાં આપણે ભારતીયોની સૌથી મોટી તાકાત બની રહી છે. આજે દેશ જે કંઈ કરી રહ્યો છે તેમાં 'સબકા મિશન'નો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આજે અમે એવી વ્યવસ્થા બનાવી રહ્યા છીએ જેમાં ભેદભાવને કોઈ સ્થાન

નથી. અમે એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ જે સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર મજબૂત રીતે ઊભું છે. આપણે એવા ભારતના ઉદભવના સાક્ષી છીએ કે જેની વિચારસરણી અને અભિગમ નવીન છે અને જેના નિર્ણયો પ્રગતિશીલ છે. પીએમ મોદીએ કહ્યું કે કિતુરની રાણી ચેનમ્મા, મતંગિની ડાજરા, રાણી લક્ષ્મીબાઈ, વીરંગના જલકારી બાઈથી લઈને અહિલ્યાબાઈ હોલ્કર અને સાવિત્રીબાઈ ફૂલે સુધી સામાજિક ક્ષેત્રમાં આ દેવીઓએ ભારતની ઓળખ જાળવી રાખી છે. મુશ્કેલ મધ્યકાલીન સમયમાં પણ આ દેશમાં પત્તાપાય અને મીરાબાઈ જેવી મહાન સ્ત્રીઓ હતી. અને અમૃત મહોત્સવમાં દેશ સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસને યાદ કરી રહ્યો છે, તેમાં પણ ઘણી મહિલાઓએ પોતાનું બલિદાન આપ્યું છે.

દેશમાં કોરોનાની મહા સુનામી, એક જ દિવસમાં ૩ લાખથી વધુ કેસ ૪૮૧ દર્દીઓનાં મોત

નવીદિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે દેશમાં કોરોનાની સુનામી આવી ગઈ છે, આ સાથે, કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા પ્રકાર ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ત્રણ લાખ ૧૭ હજાર ૫૩૨ નવા કેસ નોંધાયા છે અને ૪૮૧ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ૨૨૮૦ કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ૧૬.૪% છે.



કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને ૧૯ લાખ ૨૪ હજાર ૫૧૨ થઈ ગઈ છે. તે જ સમયે, આ

રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૪ લાખ ૮૭ હજાર ૬૮૫ થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે બે લાખ ૨૪ હજાર ૯૨૦ લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં ૩ કરોડ ૫૮ લાખ ૭ હજાર ૨૯૦ લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.

શીત લહેર સાથે હવે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ત્રણ દિવસ વરસાદની આગાહી

નવીદિલ્હી, ઈંડોનો સામનો કરી રહેલા દિલ્હી, યુપી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવે વરસાદી કહેર જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવાર અને રવિવારે દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં હવે વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. આ રાજ્યોમાં રવિવાર સુધી વરસાદ ચાલુ રહેશે.



ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારોમાં વરસાદ ગુરુવારથી જ શરૂ થઈ શકે છે. જે ૨૨ હવામાન વિભાગનું કહેવું છે કે જમ્મુ, કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ, મુજફ્ફરાબાદ અને ઉત્તરાખંડમાં પણ આગામી ત્રણ દિવસમાં વરસાદ પડી શકે છે.

પર્વતીય વિસ્તારોમાં સિવાય દિલ્હી-એનસીઆર, યુપી, હરિયાણા, સિક્કિમ, બંગાળ, બિહાર, ઝારખંડ એટલે કે પૂર્વ ભારતમાં પણ ૨૨ અને ૨૩ જાન્યુઆરીએ વરસાદ પડશે. આ ઉપરાંત મેદાની વિસ્તારોમાં સવાર અને રાત્રિ દરમિયાન ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. ખાસ કરીને યુપી અને બિહારના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે

પર્વતીય વિસ્તારોમાં સિવાય દિલ્હી-એનસીઆર, યુપી, હરિયાણા, સિક્કિમ, બંગાળ, બિહાર, ઝારખંડ એટલે કે પૂર્વ ભારતમાં પણ ૨૨ અને ૨૩ જાન્યુઆરીએ વરસાદ પડશે. આ ઉપરાંત મેદાની વિસ્તારોમાં સવાર અને રાત્રિ દરમિયાન ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. ખાસ કરીને યુપી અને બિહારના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે

NCBની મુન્દ્રા પોર્ટ પર મોટી કાર્યવાહી, વિદેશી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

લુજ, ગુજરાતના કચ્છમાં આવેલા મુન્દ્રા પોર્ટ પર એનસીબીએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં એનસીબીએ ખાતમીના આધારે વિદેશી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. તેમજ મળતી માહિતી મુજબ સ્કેપ કારના કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવીને લવાયું હતું, જેમાં એનસીબીએ અમેરિકન ગાંજા તરીકે ઓળખાતા મેરિજુઆનાના ૯૦ પેકેટ જમ કર્યા છે. તેમજ મોટી પાર્ટીઓમાં મેરિજુઆના ડ્રગ્સ લેવાનું હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે દિલ્હી એનસીબી દ્વારા ગુજરાતમાં પ્રથમવાર કામગીરી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય ડ્રગ્સ માફિયાઓના સોફ્ટ ટાર્ગેટમાં હોવાના એનસીબીના ચોકવાનારા આંકડા સામે આવ્યા. ૨૦૨૧માં ડ્રગ્સના કેસ વધ્યા છે. સાઉથ બાદ હવે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા સક્રિય થતા સેન્ટ્રલ

એજન્સીઓની ચિંતા વધી છે. જોકે ડ્રગ્સથી યુવાપેઢીને બચાવવા એનસીબી અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી માટે ડ્રગ્સ માફિયાઓ હવે અલગ અલગ તરફીઓ અપનાવી રહ્યા છે. જેથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. જેનું કારણ છે કે ડ્રગ્સ માફિયાઓ હવે ચેન્નઈ અને શ્રીલંકા દરિયાકાંઠેથી ડ્રગ્સની હેરાફેરી બંધ કરી દીધી છે. આમ તો ભારતના સાઉથ દરિયાકાંઠે ડ્રગ્સના કનસાઈટમેન્ટ હેરાફેરી સેન્ટર પોઈન્ટ હતું, પરંતુ સેન્ટ્રલ એજન્સીઓની કડક કાર્યવાહી બાદ હવે સાઉથ દરિયાકાંઠે ડ્રગ્સની હેરાફેરી પ્રવૃત્તિ બંધ કરી ગુજરાત દરિયાકાંઠાના સોફ્ટ ટાર્ગેટ બનાવ્યો છે. ડ્રગ્સને ૨૦૨૧માં ડ્રગ્સને લઈને જાહેર કરેલા આંકડાની સંખ્યાથી સાબિત થાય છે કે ડ્રગ્સ માફિયા માટે ગુજરાત હોટ ફેવરિટ બન્યું છે.

ગુજરાતનાં શહેરોની હવા મહારાષ્ટ્રનાં શહેરો કરતાં પણ વધુ પ્રદૂષિત?

ગાંધીનગર, 'ધ પ્રિન્ટ'ના અહેવાલ અનુસાર 'સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ' (સીએસઈ) દ્વારા કરાયેલ નવા વિશ્લેષણ અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેમની ભૌગોલિક અનુકૂળતાઓ છતાં વાયુપ્રદૂષણ ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે.

આધારે આવ્યું છે. એક અહેવાલ અનુસાર ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં નોંધાયેલ રહેલા નવા કોરોનાના કેસો પૈકી ૭૦થી ૮૦ ટકા કેસો ઓમિક્રોન વેરિઅન્ટના છે. આરોગ્યમંત્રીએ હોમ ટેસ્ટિંગ કિટ થકી પોઝિટિવ આવી રહેલા લોકોને પણ ડાંકટરોને પોતાનાં પરિણામની જાણ કરવા જણાવ્યું છે, જેથી કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્ય સરકાર યોગ્ય નીતિ ધરી શકે.

ત્રીજી લહેરના પ્રસાર વખતે ઓછામાં ઓછા લોકોને કિટિકલ કેરની જરૂરિયાત અને ઓક્સિજનની જરૂર પડે તે માટે આરોગ્યમંત્રીએ સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાની સાથે લોકોને કોવિડ-૧૯ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને યોગ્ય નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું.

આધારે આવ્યું છે. એક અહેવાલ અનુસાર ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં નોંધાયેલ રહેલા નવા કોરોનાના કેસો પૈકી ૭૦થી ૮૦ ટકા કેસો ઓમિક્રોન વેરિઅન્ટના છે. આરોગ્યમંત્રીએ હોમ ટેસ્ટિંગ કિટ થકી પોઝિટિવ આવી રહેલા લોકોને પણ ડાંકટરોને પોતાનાં પરિણામની જાણ કરવા જણાવ્યું છે, જેથી કોરોનાની ત્રીજી લહેરમાં રાજ્ય સરકાર યોગ્ય નીતિ ધરી શકે.

કોરોના વાઈરસથી ધરમં રહો, સરકારની વાઈરસથી સુરક્ષીત રહો.

ગભરાશો નહીં, સૂચનાઓનું પાલન કરો.

- છીંકતી વખતે/ખાંસતી વખતે મોં ઉપર રૂમાલ રાખો.
- હાથને ૨૦ સેકન્ડ સુધી વારંવાર ધુણો/સેનેટાઇઝરનો ઉપયોગ કરો.
- મોં પર માસ્ક પહેરવાનું રાખો.
- સામાજિક ૧ મીટરનું અંતર રાખો.
- જરૂરી કામ વગર ઘરની બહાર જવાનું ટાળો.
- શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો જણાય તો તરત જ ડેક્લરે જાણ કરો.

કોરોના વાઈરસથી ધરમં રહો, સરકારની વાઈરસથી સુરક્ષીત રહો.

ગભરાશો નહીં, સૂચનાઓનું પાલન કરો.

- છીંકતી વખતે/ખાંસતી વખતે મોં ઉપર રૂમાલ રાખો.
- હાથને ૨૦ સેકન્ડ સુધી વારંવાર ધુણો/સેનેટાઇઝરનો ઉપયોગ કરો.
- મોં પર માસ્ક પહેરવાનું રાખો.
- સામાજિક ૧ મીટરનું અંતર રાખો.
- જરૂરી કામ વગર ઘરની બહાર જવાનું ટાળો.
- શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો જણાય તો તરત જ ડેક્લરે જાણ કરો.

બી. બી. પટેલ

મુ. માતરીયાવાડી, તા. મોરવા(હ)

જી. એસ. બારીયા

મુ. કુવાઝર, તા. મોરવા(હ)

કેન્દ્ર સરકારની સાથે બાકી રહી ગયેલી માગોને લઈને વાતચીત કરીશું, નહીં માને તો આંદોલન : ટિકેત

નવીદિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં અને ટેકાના ભાવની માગ સાથે શરૂ થયેલ ખેડૂત આંદોલન હાલ તો સેનેટાઈઝ ગયું છે. જોકે હવે એપ્રિલ મહિનામાં ફરી આંદોલન કરવાના સંકેતો ખેડૂત નેતા રાકેશ ટિકેતે આપ્યા હતા. પ્રયાગરાજમાં ટિકેતે કહ્યું હતું કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, આ રાજ્યોમાં માર્ચ મહિના સુધીમાં સરકારો બની જશે. જેથી એપ્રિલ મહિનાથી ખેડૂતો ફરી પોતાનું આંદોલન શરૂ કરશે.



ટિકેતે કહ્યું હતું કે સરકારે ટેકાના ભાવ માટે કમિટી બનાવવાનું વચન આપ્યું હતું, સાથે જ ખેડૂતો આંદોલન દરમિયાન માયાં ગયા તેમના પરિવારને વળતર આપવાની પણ વાત કરી હતી. જે રાજ્યોમાં આંદોલન સમયે પોલીસ સ્ટેશનોમાં ખેડૂતોની સામે ફરિયાદો

દાખલ થઈ છે તેને પરત લેવાનું વચન આપ્યું હતું. આમાંથી એક પણ વચન સરકારે પૂર્ણ નથી કર્યું. તેથી જ એપ્રિલ મહિના સુધીમાં આ વચનોને પુરા કરી લેવામાં નહીં આવે તો ખેડૂતો ફરી આંદોલન શરૂ કરશે. જોકે રાકેશ ટિકેતે કહ્યું હતું કે અમે કે અમારા આંદોલનકારી ખેડૂત સંગઠનો કોઈ પણ રાજકીય પક્ષને આ ચૂંટણીમાં ટેકો નહીં આપે. આંદોલન અંગે વાત કરવા ટિકેતે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની સાથે બાકી રહી ગયેલી માગોને લઈને વાતચીત કરીશું, જો સરકાર માનશે તો

ટીકે છે અન્યથા એપ્રિલ મહિનામાં દેશવ્યાપી આંદોલન શરૂ કરી દેવામાં આવશે. ખેડૂતોની મુખ્ય માગણીઓમાં ત્રણ કૃષિ કાયદા પરત લેવા, ટેકાના ભાવ માટે કાયદાકીય જોગવાઈ કરવી, આંદોલનકારી ખેડૂતો સામેના કેસો પરત લેવા અને આંદોલન સમયે માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર આપવાની હતી. જોકે સરકારે કૃષિ કાયદા પરત લઈ લીધા છે પણ અન્ય ચાર માગોને પૂર્ણ ન કરી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. જ્યારે સરકારે બધી જ માગો સ્વીકારવાની ખાતરી આપી હતી.

સંતરાપુરના સંત ગામે ચિબોટા નદી પર ચેકડેમ બાંધવાનું મંત્રી હસ્તે ખાતમુહર્ત



તસ્વીર : બશીર પઠાણ, સંતરામપુર

સંતરાપુર, સંતરામપુર નગરના સંત ગામના ચિબોટા નદી પર ચેકડેમ બાંધવા રાજ્યકક્ષાના મંત્રી વરદ હસ્તે ખાતમુહર્ત કરાયું સંતરામપુર નગરના સંત ગામ આવેલી ચિબોટા નદી પર રૂપિયા અંદાજિત ૭૬ લાખના ખર્ચે ચેકડેમ બાંધવામાં આવશે આજે તેનું રાજ્યકક્ષાના મંત્રી વરદ હસ્તે ખાતમુહર્ત કરવામાં આવેલું હતું. જળ નર્મદા અને પાણી પુરવઠા નગરપાલિકા આયોજિત નદીની અંદર ચેકડેમ બાંધવા નું આયોજન કરવામાં આવેલું છે ઉનાળા દરમિયાનમાં પાણીનો સંગ્રહ કરી શકાય અને ઉનાળામાં

અને પશુઓ પક્ષીઓ અને અને સ્થાનિક ગ્રામજનોની પણ લાભ લઈ શકે તેના હેતુથી આ ચેકડેમ બાંધવા નું આયોજન કરવામાં આવેલું હતું. આ ખાતમુહર્ત રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડોંડોરના વરદ હસ્તે કરવામાં આવેલું હતું. જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય રાજવી પરિવારના પરમદિત્યસિંહ પરમાર આ ખાતમુહર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ સુનીતાબેન ખાંટ, ઉપપ્રમુખ હિતેશભાઈ ઉપાધ્યાય, નગરપાલિકાના સભ્ય, હોદ્દેદારો, અધિકારી, પદાધિકારી તમામ હાજર રહ્યા હતા.

આજે પણ પ્રસિદ્ધ મંદિર પરથી નથી ઉડતા વિમાન કે પક્ષીઓ



હેરાન છે.

જગન્નાથ પૂરી ચાર ધામોમાંનું એક છે. આ હિન્દુઓનું એક પ્રમુખ તીર્થ સ્થાન છે. અહિંયા આખું વર્ષ ભક્તોની ભીડ રહે છે. આ મંદિરની મહિમા તથા ચમત્કાર દુનિયામાં પ્રસિદ્ધ છે. જાણીએ જગન્નાથ પૂરી મંદિર સાથે જોડાયેલા આશ્ચર્યજનક તથ્યો તથા અદ્ભુત ચમત્કાર વિષે. જગન્નાથ પૂરી મંદિર વિષે માન્યતા છે કે તેની દેખરેખ ગરુડ પક્ષી કરે છે. ગરુડને પક્ષીઓનો રાજા માનવામાં આવે છે. આવામાં અન્ય પક્ષી આ મંદિરની ઉપરથી ઉડતાં નથી. ઉપરાંત જગન્નાથ પૂરી મંદિરના ઉપરી હિસ્સામાં આઠ ધાતુઓથી બનેલ એક ચક્ર લાગેલ છે જેને નીલચક્ર કહેવામાં આવે છે. માન્યતા છે કે આ ચક્ર મંદિરની ઉપરથી ઉડવા વાળા હવાઈ જહાજોમાં રુકાવટ પેદા કરે છે. એટલા માટે આ મંદિરની ઉપરથી કોઈ પણ વિમાન ઉડી શકતું નથી. સામાન્ય રીતે કોઈ પણ ધ્વજ હવાને અનુકૂળ લહેરાતો હોય છે પરંતુ આ મંદિરનાં શીર્ષ પર લાગેલો ધ્વજ હવાની વિપરીત દિશામાં લહેરાય છે. ધ્વજના આ રહસ્યથી વૈજ્ઞાનિકો પણ કરવામાં આવે છે.

જગન્નાથ પૂરી મંદિરમાં ચાર દરવાજા છે. મુખ્ય દ્વારને સિંહદ્વારમ કહેવાય છે. કહેવાય છે કે આ દ્વારથી મંદિરના પ્રવેશ દ્વાર પર સમુદ્રની લહેરોનો અવાજ સંભળાય છે પરંતુ મંદિરમાં પ્રવેશ કરતાંની સાથે જ લહેરોનો ઘોંઘાટ સમાપ્ત થઈ જાય છે. ભગવાનને ભોગ ચઢાવવા માટે પ્રાસાદમ પકવવાની પરંપરા છે. પ્રાસાદમ પકવવા માટે સાત વાસણો એક બીજા પર ચઢાવવામાં આવે છે. પહેલાં સૌથી ઉપર વાળા વાસણનો પ્રસાદ તૈયાર થાય છે. ત્યાર પછી ક્રમશઃ અન્ય વાસણોના પ્રસાદ તૈયાર થાય છે. હેરાન કરી દેવા વાળી વાત એ છે કે પ્રાસાદમ પકવવા માટે બળેલી લાકડીઓનો વપરાશ કરવામાં આવે છે.

હેલ્થ ટીપ્સ તમારા બાળકોની હાઈટ વધારવી હોય તો સુપરફૂડ ખવડાવો

સામાન્ય રીતે તો બધા જાણે છે કે લંબાઈ વધવાની એક નિશ્ચિત ઉંમર હોય છે અને અનુવાનિક કારણ પણ માણસની લંબાઈને નિર્ધારિત કરે છે. છતાં આ વાતમાં પણ બે મત નથી કે પોષિક ભોજન તથા સારી ડાયેટ પણ લંબાઈ વધારવામાં કારગર મનાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકની લંબાઈ સારી રીતે વધે તો તમારે તેની ડાયેટ પર સરુથી જ ધ્યાન આપવું જોઈએ. ચાલો જાણીએ કે કઈ વસ્તુઓને ડાયેટમાં શામેલ કરવાથી લંબાઈ વધારવાનાં પ્રયાસો સારું ફળ આપે છે. ૧. શકરીયાં: શકરીયાં આમ તો એક શાક છે અને લોકો તેને છૂંદીને ખાવાનું પસંદ કરે છે પરંતુ ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે શકરીયાં લંબાઈ વધારવા માટેનું સુપરફૂડ માનવામાં આવે છે. શકરકંદમાં વિટામીન એ હોય છે જેનાં કારણે હાડકાઓના સ્વાસ્થ્યને સુધારીને લંબાઈ વધારવામાં મદદ મળે છે. એટલું જ નહિ શકરકંદમાં સોલ્યુબલ અને ઈન્સોલ્યુબલ બંને પ્રકારના તત્વ હાજર હોય છે જે બાળકની ડાયજેસ્ટિવ હેલ્થને પ્રમોટ કરવાની સાથે સાથે આંતરો માટે સારા બેક્ટેરિયા બનાવે છે. ૨. સાલ્મન માછલી: જો તમે બાળકને માછલી ખવડાવો છો તપ સાલ્મન માછલી ખવડાવો. સાલ્મન માછલીમાં ઓમેગા-૩ ફેટી એસીડ હોય છે જે બાળકના શરીરની ગ્રોથ તથા લંબાઈ માટે ઘણું સારું માધ્યમમાં આવે છે. ઓમેગા-૩ ફેટી એસીડમાં હૃદયના સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડવાવાળા તત્વો પણ શામેલ હોય છે. ૩. બેરીજ: બધીજ જાતની બેરીજ જેવી કે બ્લુબેરી, સ્ટ્રોબેરી, બ્લેકબેરી કે રસબેરીમાં ઘણાં પ્રકારનાં વિટામિન્સ તથા ન્યુટ્રીશન છે જે બાળકોનાં ગ્રોથ માટે જરૂરી છે. બેરીજમાં હાજર રહેલાં વિટામીન સી શરીર કોશિકાઓનો વિકાસ કરે છે અને શરીરના ટીશ્યુસ રિપેર કરવાનું કામ કરે છે. એટલું જ નહિ વિટામીન સી કોલેજનના સિંથેસીસને પણ વધારે છે જેથી બાળકની લંબાઈ અને ગ્રોથ વધે છે. ૪. પત્તાદાર શાક: બાળકને પત્તાદાર શાક જેવાંકે પલક અને કોબી ખવડાવવી જોઈએ. આ શાકમાં વિટામીન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશીયમ અને પોટેશિયમની સાથે સાથે વિટામીન કે હોય છે. જે શરીરમાં હાડકાઓનું ધનાત્વ એટલે કે વોલ્યુમ વધારે છે અને જેનાથી લંબાઈ વધે છે. ૫. ઈંડા: ઈંડા પણ આમ તો સુપરફૂડ છે. ઈંડાને પોષણનું પાવરહાઉસ કહીએ તો ઉચિત રહેશે. બાળકોના નરમ હાડકાઓના સ્વાસ્થ્ય માટે ઈંડામાં ઘણાં જરૂરી પોષક તત્વો હોય છે. આ શરીરમાં મસલ્સ તથા ટીશ્યુસના ગ્રોથ માટે પણ કારગર છે.

શહેરા પસનાલ પાટીયા પાસે વાનનું ટાયર ફાટતાં પિતા-પુત્રનું મોત



તસ્વીર : તુષાર દરજી, શહેરા

શહેરા, પિતા જયંતિભાઈને શરીરે ગંભીર ઈજા થવા સાથે અડધો પગ કપાઈ જતા ૧૦૮ દ્વારા સારવાર અર્થે તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આયા હતા. અહીં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની તબીયત નાજુક હોવાથી તમને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસનો સ્ટાફ બનાસ ખાતે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૂતકના સગા સંબંધીઓને આ બનેલા બનાવની જાણ કરતા પ્રસંગમાં હાજર હતા. લગ્ન પ્રસંગમાં આજી આપીને તેઓ પોતાના ગામ ખાતે જવા નીકળ્યા હતા. ત્યારે શહેરા ગોધરા હાઈવે માર્ગ ઉપર પસનાલ પાટીયા પાસે માઝૂતી વાનનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જોકે, આ બનેલા બનાવમાં માઝૂતી વાનના ચાલક અક્ષય દેવડાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલકના

મહારાષ્ટ્રમાં ૨૪ જાન્યુઆરીથી ૧ થી ૧૨ ધોરણની શાળાઓ ખુલશે!

મુંબઈ, મહારાષ્ટ્રમાં સોમવાર, ૨૪ જાન્યુઆરીથી ધોરણ ૧ થી ૧૨ સુધીની શાળાઓ ફરી શરૂ થવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી છે. કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને શાળાઓ ખોલવામાં આવશે. રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડાએ કહ્યું કે અમે કોવિડ પ્રોટોકોલ સાથે ધોરણ I થી XII સુધીની શાળાઓ ખોલવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ અમારા પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે કોવિડ ટાસ્ક ફોર્સ અને વાલીઓ તરફથી સતત માંગ કરવામાં આવી રહી હતી કે શાળા જલ્દી ખોલવામાં આવે, ત્યારબાદ રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ કોવિડની અલગ-અલગ સ્થિતિ છે, તેથી સ્થાનિક સ્તરે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર બાળકોના સ્વાસ્થ્ય અને માતા-પિતાની સંમતિ અનુસાર નિર્ણય લેશે. ૧ થી ૧૨ જાન્યુઆરી ૨૪ થી શરૂ થશે.. કોવિડ એસઓપી અને માતાપિતાની સંમતિ જરૂરી છે. વર્ષા ગાયકવાડે વધુમાં કહ્યું કે કોવિડની સંખ્યા વધ્યા બાદ અમે શાળા બંધ કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ચાલશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શાળાઓ ખોલવાનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશમાં કોરોનાની ગતિ ફરી એકવાર ઝડપી બની છે. ગુરુવારે છેલ્લા ૧૨ કલાક દરમિયાન ૩ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. અહીં, મહારાષ્ટ્રના યાણે જિલ્લામાં કોવિડ-૧૯ના ૩૮૬૫ નવા કેસના આગમન સાથે, સંક્રમિતોની સંખ્યા વધીને ૬,૮૧,૪૨૦ થઈ ગઈ છે. એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. વાયરસના ચેપને કારણે વધુ અટક દર્દીઓના મૃત્યુ સાથે, મૃત્યુઆંક વધીને ૧૧,૬૭૮ થયો છે. તેમણે કહ્યું કે યાણેમાં મૃત્યુ દર ૧.૭૧ ટકા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે પડોશી વાલધર જિલ્લામાં કુલ કેસ વધીને ૧,૫૮,૧૭૧ થઈ ગયા છે અને મૃત્યુઆંક ૩૩૫૧ છે.

સંતરામપુર FCI ગોડાઉન માં મહિસાગર જિલ્લાના કલેક્ટરના આદેશ મુજબ સંતરામપુર મામલતદાર તપાસ હાથ ધરી હતી



તસ્વીર : બશીર પઠાણ, સંતરામપુર

સંતરામપુર, સંતરામપુરની FCI ગોડાઉન માં અનાજ પુરવઠો સરતા અનાજની દુકાનોમાં પહોંચાડવામાં આવતો અનાજના જથ્થાનો આજે સંતરામપુર મામલતદાર FCI ગોડાઉન માં તપાસ હાથ ધરી હતી. અલગ-અલગ વિગતોમાં અનાજના ઘઉં ચોખા ખાંડ પુરવઠાનો તમામ માલની વિગત મહિસાગર જિલ્લાના કલેક્ટરના આદેશ મુજબ સંતરામપુરની FCI ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં

આવેલી હતી. જે દરમિયાનમાં સ્ટોક જથ્થો કેટલો હાજર છે. અદાલત ગોધરા સમક્ષ રેકૉર્ડ્સ કરી ચલાવવામાં આવતા આ કામના અરજદાર તરફ ફેડરેશનના એડવોકેટ સંતોષ.એ. ભોઈ તથા વૈભવ આઈ. ભોઈ એ ફેડરેશનના પ્રમુખના માર્ગદર્શન હેઠળ નામદાર ગુજરાત હાઈકોર્ટના કેટલાક હુકમો ટાંકી દલીલો કરતાં આ કામના અરજદાર અમરાભાઈ પગાર સહિત તેમની મૂળ જગ્યાએ પ્રસ્થાપિત કરવા નોટિસ પાઠવેલ સંસ્થા તરફથી નોટિસ નો કોઈ પ્રત્યુત્તર ન મળતા આ વિવાદ નામદાર મજુર

મજુર અદાલત ગોધરા દ્વારા ભાદર નહેર વિતરણના પાંચ શ્રમયોગીઓને ન્યાય મળતા પંચમહાલ અને મહિસાગર જિલ્લાના સિંચાઈના કામદારોમાં આનંદ અને ઉત્સાહ

ગોધરા, પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં ભાદર નહેર વિતરણ વિભાગમાં સન ૧૯૯૫ થી રોજમદાર મજુર તરીકે ફરજ બજાવતા અમરાભાઈ સોમાભાઈ પગી ભાથીભાઈ નાના તલાર ભાઈ રૂપાભાઈ પગી ઉદા માલાભાઈ પગી વિગેરે ને સંસ્થા દ્વારા ૨૦૧૧ના વર્ષમાંલાંબા સમયની નોકરી માંથી મજુર કાયદાન ની જોગવાઈઓનો ૨૫ એફ તથા ૨૫ એચ નું ઉદ્દંધન

કરી ગેરકાયદેસર રીતે નોકરીમાંથી છૂટા કરી દેતા પ શ્રમયોગી ઓ એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભાઈનો સંપર્ક કરતા ફેડરેશ દ્વારા સંસ્થાના અધિકારીઓને ઔદ્યોગિક વિવાદ ધારા ૧૯૪૭ ભાથીભાઈ રૂપાભાઈ પગી ઉદા ની કલમ ૧૦ હેઠળ તમામ કામદારોને પડેલા દિવસોના પુરા પગાર સહિત તેમની મૂળ જગ્યાએ પ્રસ્થાપિત કરવા નોટિસ પાઠવેલ સંસ્થા તરફથી નોટિસ નો કોઈ પ્રત્યુત્તર ન મળતા આ વિવાદ નામદાર મજુર

અદાલત ગોધરા સમક્ષ રેકૉર્ડ્સ કરી ચલાવવામાં આવતા આ કામના અરજદાર તરફ ફેડરેશનના એડવોકેટ સંતોષ.એ. ભોઈ તથા વૈભવ આઈ. ભોઈ એ ફેડરેશનના પ્રમુખના માર્ગદર્શન હેઠળ નામદાર ગુજરાત હાઈકોર્ટના કેટલાક હુકમો ટાંકી દલીલો કરતાં આ કામના અરજદાર અમરાભાઈ પગાર સહિત તેમની મૂળ જગ્યાએ પ્રસ્થાપિત કરવા તથા ખર્ચ પેટે પ્રત્યેક કામદારને રૂપિયા ૫૦૦૦ ચૂકવવાનો

આદેશ કરેલ છે અને અરજદાર જવાન માલા પગીને તેમનો નિવૃત્તિનો ૬૦ વર્ષનો સમય ગાળો પૂર્ણ થતા નોકરીની મૂળ જગ્યાએ પુના સ્થાપિત કરવા તથા પડેલા દિવસોના પગાર પેટે ઉચ્ચક રૂપિયા ૧૫૦૦૦૦ તથા રેકૉર્ડ્સ ખર્ચ પેટે રૂપિયા ૫૦૦૦ ચૂકવવા નામદાર મજુર અદાલત ગોધરાના ન્યાયાધીશ ડી.જે. વ્યાસ આદેશ ફરમાવતા સિંચાઈ વિભાગના પંચમહાલ અને મહિસાગર જિલ્લાના કામદાર આલમમાં આનંદની લહેર છવાઈ છે.

શહેરા તાલુકાના વાડી ગ્રામ પંચાયતની ચુંટાયેલ ટીમે ડેપ્યુટી સરપંચની બિન હરીફ વરણી કરી



શહેરા, શહેરા તાલુકામાં તમામ જ્ઞાતીની વસ્તી ધરાવતા વાડી ગામે એક માસ અગાઉ ગ્રામ પંચાયતના સરપંચની ચુંટણી યોજાઈ હતી. જેમાં માછી સમાજના રમેશભાઈ બીજલભાઈ માછી (નિવૃત્ત તલાટી) જંગી બહુમતીથી વિજેતા થયા હતા. આ ચુંટણી બાદ બુધવારે સરપંચ પદના ચાર્જ તથા ડેપ્યુટી સરપંચ પદની ચુંટણી માટે મળેલ પ્રથમ મિટિંગ સમયે નવી સભ્યોએ સુભકસિંહ સામતસિંહ સોલંકીની બિન હરીફ ડેપ્યુટી સરપંચ પદે વરણી કરી હતી. રમેશભાઈ માછીના સમર્થકોએ ઉત્સાહ ઉમંગભરે એકત્ર થઈ તમામ સમાજોમાં એકતા સ્થાપિત કરનાર વિનોદભાઈ માછી નિરંકારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ચુંટાયેલ તમામ સભ્યોનું ફુલહારથી સ્વાગત કર્યું હતું તથા સમગ્ર ચુંટણી દરમિયાન ભકિતસભર માહોલ ઉભો કરી તમામ સમાજોમાં એકતા સ્થાપિત કરનાર વિનોદભાઈ માછી નિરંકારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગરબાડા પંચાયતમાં બંધ પડેલ ભુગર્ભ ગટરલાઈનની DDOએ મુલાકાત લઈ પુનઃ શરૂ કરવા સુચનો કર્યા

ગરબાડા, ગરબાડામાં તા.૧૯ના રોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગરબાડા ગામની અધુરી ભુગર્ભ ગટર યોજના અને તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી. અને હાલમાં બંધ હાલતમાં પડી છે તે ભુગર્ભ ગટર વિશેષ ચર્ચા કરી અને ગામના કેટલાક વિસ્તારની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે ગરબાડા તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી અને ગરબાડા ગામની અધુરી ભુગર્ભ ગટરને લઈને તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ તથા જિલ્લા બાંધકામ શાખાના એક્ઝીક્યુટિવ એન્જિનિયર પટેલ ડે.એન્જિનિયર સંગાડા સાથે ગરબાડાની ભુગર્ભ ગટર વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ કામગીરીવાવાડ બસ સ્ટેશન વિસ્તારની સ્થળ પર જઈ અને ગટરના ગંદા પાણી જે રોડ વર્ષોથી લીકેજ થાય તેની નિરીક્ષણ કર્યું હતુ. ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને જિલ્લા વિકાસ અધિકારીએ લોકોને હાઉસ

કનેક્શન આપવા સુચન કર્યું હતુ. અને લાઈનમાં જે પણ ખામી હોય તે જિલ્લા પંચાયત દ્વારા જેટિંગ મશીન ફાળવીને સાફસફાઈ કરીને પુનઃ આ યોજના ચાલુ કરવા સુચન કર્યું હતુ. જિલ્લા પંચાયતના એન્જિનિયરો દ્વારા બધા જ ચેમ્બરોની જેટિંગ મશીનથી સાફસફાઈ કરાવવા માટેના પણ આદેશ આપ્યા હતા. ગરબાડા નગરમાં ૨૦૧૨માં કરોડોના ખર્ચે ચાલુ કરવામાં આવેલ ભુગર્ભ ગટર યોજના આજે ૨૦૨૨માં પણ શોભાના ગાંઠિયા સમાન અધુરી જોવા મળી રહી છે જેને ચાલુ કરવા માટે મથામણ કરવામાં આવી રહી છે જ્યારે અગાઉ ૨૬ જાન્યુઆરી ૨૦૧૪માં યોજના પુર્ણ બતાવી તેનું લોકાર્પણ વિધિ કરવાની હતી પરંતુ ગ્રામજનોએ તેનો વિરોધ કરી લોકાર્પણ રોક્યું હતુ. તેમજ યોજના બાબતે ધારાધોરણ મુજબની કામગીરી થાય તે માટે ગરબાડાના માજી ડે.સરપંચ જયેશભાઈ જોશી દ્વારા હાઈકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરવામાં આવેલ છે.

ગુજરાતના ચાર ગામડામાં હવે 'દારૂબંધી'નો કાનુન લાગુ નહિં થાય

ગાંધીનગર, ગુજરાતમાં દારૂબંધી છે છતા તેની આસપાસના રાજ્યો રાજસ્થાન-મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસનના પ્રદેશ દિવ-દમણ-દાદરાનગર હવેલીમાં દારૂબંધી નહી હોવાથી આ ક્ષેત્રમાંથી દારૂની મોટી ખેપ ગુજરાતમાં ઠલવાઈ છે અને ગેરકાનુની રીતે શરાબ છૂક પંજાબથી પણ ગુજરાતમાં આવે છે તે વાસ્તવિકતા છે પણ ગુજરાતમાં આ સરહદી ક્ષેત્રનાં ચાર ગામડાઓ પણ ટુંક સમયમાં કોઈ કાનુની ચિંતા વગર શરાબની મોજ માણી શકશે. કેન્દ્ર શાસનની પ્રદેશ દિવ-દમણ દાદરાનગર હવેલી અને

ગુજરાત વચ્ચે સરહદી ક્ષેત્રમાં ટેકનીકલ કારણોસર આ ચાર ગામડાઓને કેન્દ્ર શાસીત પ્રદેશમાં જોડી દેવાશે જેથી ત્યાં ગુજરાતનાં નવી કેન્દ્ર શાસીત પ્રદેશના કાનુન લાગુ થશે અને દારૂબંધી નહી હોય જે ચાર ગામડાઓ કેન્દ્ર શાસીત પ્રદેશ બની રહ્યા છે. તેમા વલસાડ જીલ્લાના કપરડા તાલુકાનાં મેઘવલ, નગર, રીયમલ અને મધુબનનો સમાવેશ થાય છે. તો દિવ પાસે જે ઘોઘલા ગામે છે તેનો થોડો ભાગ દિવ- સાથે જોડાશે જેથી ત્યાં પણ દારૂબંધી લાગુ નહિં પડે આ અંગેનું જાહેરનામું ટુંક સમયમાં જ બહાર પડશે.

આપની આજ.....

મેષ (અ.લ.ઈ.): કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે, સ્નેહીના સંપર્કથી લાભ થશે, વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.): સરકારી કામમાં સફળતા મળશે, કરેલા કાર્યો ફળદાયી બનશે, નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશે. મિથુન (ક.છ.ઘ.): કામમાં નિરાશાનો અનુભવ થશે, સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે, ઇષ્ટમીત્રોનો સહયોગ મળશે, ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે. કર્ક (ક.હ.): ધન માનનો વ્યય જણાશે, નોકરીમાં પરેશાની રહેશે, માનસિક તણાવ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે. સિંહ (મ.ત.): કામકાજમાં સફળતા મળશે, ધંધામાં નવી તકો મળશે, નોકરીમાં બદલીની તકો મળશે, પારિવારિક સબંધોમાં લાભ થશે. કન્યા (પ.ઠ.ણ.): ધંધાના કામમાં સફળતા મળશે, પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો, આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે. તુલા (ર.ત.): ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે, નવા સબંધોમાં નિરાશા જણાશે, નોકરીમાં નવી તકો મળશે, સંતાનપક્ષે શુભ સમાચાર મળશે. વૃશ્ચિક (ન.ય.): પરિશ્રમ પછી પણ કામ અધુરું જણાશે, સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલીત જણાશે, નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં ધનલાભ થશે. ધન (ભ.ધ.ક.ઢ.): આજે ભાગ્ય અનુકૂળ જણાય છે, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે, વિકાસના કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે. મકર (મ.જ.): વાદવિવાદના કામથી બચવું, આર્થિક સ્થિતિમા મધ્યમ સુધારો જણાય છે, ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે. કુંભ (ગ.શ.પ.સ.): કામની સફળતામાં ખુશી અનુભવશો, નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે, સ્વજનોનો સહયોગ મળશે, ધંધામાં સુધારો જોવા મળશે. મીન (દ.ચ.ઝ.થ.): માનસિક તણાવ જણાશે, કામમાં મધ્યમ સફળતા મળશે, વિરોધીઓથી સાવધાન રહેવું, ખર્ચ બાબતે સંભાળવું.

ગોધરાના શહેરા ભાગોળ રેલ્વે ફાટક બંધ રહેતા ટ્રાફિકની ભારે સમસ્યા

ગોધરા, ગોધરા શહેરના મુખ્ય બજાર અને ભુરાવાવને જોડતા માર્ગ ઉપર શહેરા ભાગોળ રેલ્વે ફાટક આવેલ છે. મુંબઈ-દિલ્હીને જોડતા રેલ્વે લાઈનના કારણે દિવસભર હજારો ટ્રેનો પસાર થતી હોવાને લઈ રેલ્વે ફાટક મોટાભાગે બંધ રહેતી હોય પરિણામે કાયમી ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. તેના નિવારણ કરવા માટે જીલ્લા કક્ષાએથી શહેરના નાગરિકો તેમજ પાલિકા દ્વારા રેલ્વે વિભાગમાં અનેક રજુઆતો કરવામાં આવતાં શહેરા ભાગોળ ફાટક પાસે રેલ્વેના અન્ડરબ્રીજની મંજૂરી મળેલ છે. તેમ છતાં ટેકનીકલ કારણોસર રેલ્વે અન્ડરબ્રીજની કામગીરી શરૂ થઈ શકી નથી. પરિણામે ભુરાવાવ વિસ્તારના રહીશો



પરિણામે શહેરા ભાગોળ રેલ્વે ફાટકની બંને બાજુએ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. શહેરા ભાગોળ રેલ્વે ફાટકની કાયમી

- રેલ્વે અન્ડર બ્રીજ મંજૂરી બાદ ટેકનીકલ કારણોસર ખોરંભે પડેલ પ્રોજેક્ટને પુરો કરવા તંત્ર ધ્યાન આપે.
- શહેરા ભાગોળ રેલ્વે અન્ડર બ્રીજની મંજૂરી સાથે ગ્રાન્ટ પણ સપ્લાય હતી પરંતુ કયા કારણોસર પ્રોજેક્ટ પુરો થઈ શક્યો નથી.

ઉકેલ માટે પશ્ચિમ રેલ્વે સાથે જાગૃત નાગરિકો નગર પાલિકા તંત્ર અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવાર લેખિત રજુઆતો બાદ પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા રેલ્વે ઓવરબ્રીજની મંજૂરી મળી હતી. જે ટેકનીકલ કારણોસર મોકુફ રાખવામાં આવી હતી. બાદમાં રેલ્વે વિભાગ દ્વારા શહેરા ભાગોળ રેલ્વે ફાટકના સ્થાને અન્ડર બ્રીજની મંજૂરી આપવામાં આવી હતી અને

અન્ડર બ્રીજ માટેની ગ્રાન્ટ પણ પાલિકાને ફાળવવામાં આવી હતી. પરંતુ પશ્ચિમ રેલ્વે ટેકનીકલ વહીવટી મંજૂરી અટકી જતા રેલ્વે અન્ડર બ્રીજ માટે આવેલ ગ્રાન્ટનો હેતુકેર કરીને તત્કાલીન પાલિકા પ્રમુખ દ્વારા અટલ ભાગના રીનોવેશન માટે ફાળવી દેવામાં આવી હતી. ત્યારબાદ શહેરા ભાગોળ રેલ્વે અન્ડર બ્રીજની માંગણી જાણે ખોરંભે પડી હોય તેમ લાગી રહ્યું છે. શહેરા ભાગોળ રેલ્વે અન્ડર બ્રીજ

બંને તો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રહેતા વાહન ચાલકો માટે અપાર-નવાર માટે સુવિધા મળી રહે તેમ છે. સાથે મુખ્ય ઓવરબ્રીજ ઉપર વાહનોનો ટ્રાફિક ઓછો થાય તેમ છે. શહેરા ભાગોળ રેલ્વે ફાટક ટ્રેન પસાર થવાના સમયે બંધ હોવાથી અમુક ડ્રિયકી વાહન ચાલકો અને રાહદારીઓ રેલ્વે ટ્રેક ઓળંગી લેવાના પ્રયાસોમાં જીવ ગુમાવવાના બનાવો પણ બન્યા છે. તેનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. ત્યારે ગોધરા શહેરના નગરજનોની મોટી સમસ્યા સમાન શહેરા ભાગોળ રેલ્વે ફાટકના સ્થાને રેલ્વે અન્ડરબ્રીજ બને તે માટે જીલ્લા વહીવટી તંત્ર, નગર પાલિકા સાથે રાજીને પશ્ચિમ રેલ્વેમાં અટકી પડેલ અન્ડર બ્રીજની પ્રોજેક્ટને પુરો કરવાના સહીચારા પ્રયાસ કરે અને નગરજનોની કાયમી સમસ્યાનો સુખઃદ ઉકેલ લાવવા પ્રયત્ન કરે તે જરૂરી છે.

કાલોલની સંગીરા અપહરણ કાંડમાં કેટલાક દૈનિક અખબારોમાં અડધા રોટલે દાળ લઈ ભાગતા અહેવાલો વિરૂદ્ધ પરિવારજનોમાં આક્રોશ

કાલોલ, પંચમહાલ જિલ્લાના બવચર્ચિત એવા એક તાલુકામાં ખેતીકામ અને છૂટક મજૂરી કરી જીવન ગુજરાત ચલાવતા એક શ્રમજીવી પરિવારની પુત્રીના અપહરણ કાંડની સ્થાનિક પોલીસ તપાસના ઘટનાક્રમો બાબતેની સત્યતા કથા વિના સસ્તી પ્રસિદ્ધિની લાલચે ખોટા અને સત્યથી વેગળા જુઠા ભ્રામક સમાચારો છાપનાર કેટલાક અગ્રણી દૈનિક અખબારોનાએ અહેવાલોથી અપહરણ બાળાના પરિજનોમાં આક્રોશ વ્યાપ્યો છે.



તસ્વીર : જયવીર સોલંકી, કાલોલ

અપહરણકાર ચુપક હાર્દિક સોલંકી વિરૂદ્ધ તાલુકા મથકના પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી ભાગેડુ ચુપકને સગીર બાળા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કાલોલ પોલીસ દ્વારા આરંભાયેલી કાયદેસરની કાર્યવાહીઓ મધ્યે આરોપી ચુપક અને સગીર બાળા પેકી ચુપકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેને પોલીસ જાસા તળે ગત. તા.૧૮ જાન્યુઆરીના રોજ બાળાના જ શહેરમાં રહેતો

જણાવી હતી. સાથે સાથે ઘટનાની તપાસ સાથે સંકળાયેલ પોલીસ અધિકારી સાથેની ટેલિફોનિક વાતચિત દરમિયાન તપાસ અધિકારીએ પણ સદર બાળા પોલીસના કબજામાં હોવાની બાબતોને પુષ્ટ કરી હતી. ઉપરોક્ત પ્રકારના કિસ્સાઓમાં સગીર બાળા કે પીકિત ચુપતીને તેના પરિવારને સોંપતા પહેલા એક લાંબી કાયદાકીય જોગવાઈઓમાંથી પસાર થવું પડતું હોય છે. જેમાં ક્યારેક સમય પણ થઈ જતો હોય છે ત્યારે પ્રથમ દ્રષ્ટિએ બીન અભ્યાસી રીતે પૂર્ણ જાણકારી વિના આવી સંવેદનશીલ ઘટનાઓને પ્રકાશિત કરવાની દૈનિક અખબારોની નિતી-રીતિઓ સામે ખાખને પરત કરી હોવાના અહેવાલો પ્રકાશિત થયેલા જોઈ બાળાના જીવન સંબંધિત ચિંતાઓ સાથે પરિવારનો ઊંડી ચિંતાઓમાં ગરકાવ થયો હતો. પરિવાર સાથેની ખાસ મુલાકાતમાં સગીરાના મા-બાપે પોતાની પુત્રી પોલીસે પરત સોંપી નહિ હોવાની હકીકતો

શહેરા ધારાસભ્ય દ્વારા વન વિભાગની જમીનના ગેરકાયદેસર કબજાના આક્ષેપની રજુઆત કરતાં જે.બી. સોલંકીને ગાંધીનગર આંદોલન કરવા જતા ડીટેઈન કરાયા

શહેરા, શહેરા ધારાસભ્ય અને વિધાનસભા ઉપાધ્યક્ષ દ્વારા વનવિભાગની જમીન ગેરકાયદેસર અધિગ્રહણ કરી તેમાં પાકું બાંધકામ કરવામાં આવેલ હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતના સભ્ય જે.બી.સોલંકી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ હતી. અને ૧૦ દિવસમાં દૂર ન થાય તો ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તાલુકા પંચાયત સભ્ય તેમજ તેના સમર્થકો ગુરૂવાર ના રોજ ગાંધીનગર આંદોલન માટે જતા ગાંધીનગર પાસે માર્ગમાં જ તેઓને આંતરી હસ્તગત (ડીટેઈન) કરવામાં આવ્યા હતા.



શહેરા, તાલુકા પંચાયતના એક માત્ર કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા દ્વારા થોડા જાન્યુઆરી થી ગાંધીનગરમાં

આંદોલન કરવામાં આવશેનું જણાવ્યું હતું. જે અનુસંધાનમાં ૧૯મી જાન્યુઆરીની રાત્રીએ જશવંતસિંહ ઉર્ફે જે.બી.સોલંકી તેમજ તેઓના સમર્થક ગાંધીનગર તરફ જતા હોવાની બાતમી શહેરા પી.આઈ.નિતીન યોધરી ને મળતાં તેઓ દ્વારા પોલીસની અલગ-અલગ ટુકડી બનાવી સગડ મેળવવાના પ્રયાસો ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સ થકી મેળવી ગુરૂવારની સવારના ૯ થી ૧૦ ના સમય ગાળામાં ગાંધીનગર પાસે આવેલા ઘણા ગામે માર્ગમાં જ તેઓને તેમજ તેઓના સમર્થકોને આંતરી હસ્તગત કરી શહેરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. અત્રે ઉદ્દેખનીય છે કે, રાતભર શહેરા પોલીસ અને વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી વચ્ચે સંતાપકૂકીની રમત રમાતી રહી હતી. આમ, લાંબી

૯૬મજલ બાદ પોલીસ વિરોધપક્ષના નેતા અને તેના સમર્થકો ને હસ્તગત કરવામાં સફળ રહી હતી. ઉદ્દેખનીય છે કે, જે રીતે તાલુકા પંચાયત સભ્ય જશવંતસિંહ સોલંકી દ્વારા વિધાનસભાગૃહમાં ઉપાધ્યક્ષએ જંગલની જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ કર્યો હોય ત્યારે જિલ્લા કલેક્ટર તેમજ મુખ્યમંત્રી દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી ખરી હકીકત શું છે? અને પ્રજાજનો પણ આ બાબતે જાણી શકે તો નવાઈ નહીં. હાલ તો પોલીસ તંત્ર દ્વારા તાલુકા પંચાયત સભ્ય ને ગાંધીનગર જતા રોકી ને આંદોલન કરતા રોકી લીધા હોય પણ આવનાર દિવસમાં તેઓ દ્વારા આ મામલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું તેમની પાસેથી જાણવા મળ્યું હતું.

પંચમહાલ જિલ્લાની હદમાં મેહલોલ રોડ ઉપર આવેલ ખરસાલીયા ફાટક પાસે ઇન્કમટેક્સ વિભાગની રાત્રે તોડ બાજની રેડ



તસ્વીર : નુર બાલા, વેજલપુર

વેજલપુર, પંચમહાલ જિલ્લાના મેહલોલ રોડ ઉપર આવેલ ખરસાલીયા રોડ ઉપર જાણવા મળીયા મુજબ સેન્ટ્રલ ઇન્કમટેક્સ સુભાનપુરા વિભાગના અધિકારીઓ દ્વારા પાંચ જેટલી ગાડીઓ પાસ પરમીટ કે પાકું ઇન્કમટેક્સ બીલો વગર પકડવામાં આવી હતી. ત્યારે સેન્ટ્રલ ઇન્કમટેક્સ સુભાનપુરા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા તમામ ગાડીના ડ્રાયવર પાસે થી પાસ પરમીટ માંગવામાં આવ્યું હતું. પરંતુ ગાડીઓ વાળાઓ પાસે પાસ પરમીટ ન હોવાથી એક કદાક જેટલા સમય સુધી રકઝક કરીને ઇન્કમટેક્સના અધિકારીઓએ સ્થળ ઉપર તોડ બાજ કરી હતી અને આ તોડ બાજની જાણ પત્રકારોને થતા સ્થળ ઉપર જઈ સુભાન પુરા ઇન્કમટેક્સના અધિકારીઓનું બાઈટ લેવાનું શરૂ કર્યું હતું અને

તેઓને બાઈટમાં પૂછપરછ કરતા કે, સાહેબ તમે આ ગાડીઓ વાળા પાસે શું માંગ્યું હતું અને કેટલા રૂપિયા લઈને જવા દીધા ત્યારે તેઓ દ્વારા જણાવ્યું હતું કે, અમે તેઓ પાસે બીલો ચેક કરીયા ત્યારે તેઓને એ સવાલ પૂછતા કે, તમે આ તમામ ગાડી કેમ જાસામાં લીધા વગર જવા દીધી અને એક એક ગાડી વાળા પાસે થી દસ દસ હજાર શાના લેવામાં આવ્યા છે. થોડી બાઈટ આપી ઇન્કમટેક્સના અધિકારીઓ પોતાની ગાડીઓ લઈ એક ગાડી વેજલપુર તરફ અને બીજી ગાડી ખરસાલીયા ફાટક તોચણાં તરફ સિંગલ પહીં રોડ પર અંદરના રસ્તે ફરાર થયા હતા. જેથીએ પણ સવાલ થાય છે કે, આ અધિકારીઓ સાચા હતા અને તેઓએ તોડ બાજ કરી ન હતી, તો પુરી બાઈટ આપ્યા વગર ત્યાંથી ફરાર કેમ થયા તેપણ એક સવાલ છે.

ગોધરા તાલુકાના કાંકણપુર ગામમાં ગટરો ઉભરાતાં આવતા રસ્તામાં લોકો ત્રાહીમામ



ગોધરા, ગોધરા તાલુકાના કાંકણપુર ગામમાં સ્વચ્છતાના અભાવના કારણે સુધારીયા ફળીયામાં ગટરોનું પાણી રોડ પર ઉતરી આવ્યું હતું. જેમાં રસ્તામાં અવર-જવર કરતા લોકોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કાંકણપુર સિવિલ રોડ પર અસંખ્ય માત્રામાં પાણી રોડ પર ઉતરી આવે છે. જેના કારણે કોલેરા, મેલેરિયા, જેવા રોગો ફાટી નીકળે છે. આ ફળિયામાં આશરે ૨૦-૩૦ જેટલા લોકો હાલ કોલેરાથી બીમાર હાલતમાં છે અને અત્યારે કોવિડ-૧૯નો સમય ચાલી રહ્યો છે. તેમાં સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે.



પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં કે.સરપંચની ચુંટણીની કામગીરી શરૂ થઈ છે. ત્યારે અંબાલી ગ્રામ પંચાયતના કે.સરપંચની ચુંટણીમાં એસ.પી. પટેલ વિસ્તરણ અધિકારીના અધ્યક્ષ સ્થાને તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં ચોજવામાં આવી હતી. જેમાં અંબાલી ગ્રામ પંચાયત કે.સરપંચ માટે સમીર પટેલનું એક જ ક્ષેત્ર આવતાં ચુંટણી અધિકારીએ સમીર પટેલને કે. સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા હતા. આ પ્રસંગે ગામના સામાજિક આગેવાનો ધનજીભાઈ મકવાણા, મનોજ ગુજરાતી વિગેરે હાજર રહી સમીર પટેલને અભિનંદન આપ્યા હતા.



ધોઘંબા તાલુકાની બીલોડ ગ્રામ પંચાયત છેલ્લા પાંચ દમથી સમરસ થતી હોય છે. જોકે, બીલોડ ગ્રામ પંચાયતમાં સમરસ ના ભાગરૂપે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ અને સભ્યો ને સારા માર્ગદર્શન આપી. ગ્રામ પંચાયતની ચૂંટાયેલ કમિટી દ્વારા ગામ નો સારો એવો વિકાસ કરતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બીલોડ ગ્રામ પંચાયતને સમરસ જાહેર કરવામાં આવી નથી. જ્યારે ૧૯ જાન્યુઆરી ના રોજ ઉપસરપંચ માટેના એજન્ટા પ્રમાણે ચૂંટણી રાખવામાં આવી હતી. પરંતુ ગામની એકતા સાથે માત્ર એક જ ઉમેદવાર જાદવ જશોદાબેને બાબુસિંહ નું ફોર્મ રજુ થયું હતું.

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ ૧૧૦ પોઝીટીવ કેસ નોંધાયા

ગોધરા, પંચમહાલ જિલ્લામાં કોરોના વિસ્ફોટ આજ રોજ કોરોનાના ૧૧૦ પોઝીટીવ કેસ નોંધાયા પામ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં ૯૦ પોઝીટીવ દર્દીઓ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૨૦ પોઝીટીવ કેસ નોંધાયા પામ્યા છે. જિલ્લાના સાજા થતાં ૨૪૫ અપાઈ છે. જિલ્લામાં એક દિવસમાં કોરોના દર્દીના આંક ૧૦૦ને પાર કરતાં જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. લોકોને કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.

વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ચિંતીત બન્યું છે. જિલ્લાવાસીઓને કોરોના સંક્રમણથી બચવા માટે કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરાઈ છે. કોરોના સંક્રમણથી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય એક માત્ર મારસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને સંક્રમણથી બચી શકાય છે. પંચમહાલ જિલ્લામાં આજરોજ ૨૯ દર્દીઓ કોરોના મુક્ત થતાં ૨૪૫ અપાઈ છે. હાલમાં જિલ્લામાં એક્ટીવ દર્દીની સંખ્યા ૨૭૬ સુધી પહોંચી છે. ત્યારે જિલ્લાવાસીઓ કોવિડ ગાઈડ લાઈનનું પાલન ચુસ્તપણે કરીને સંક્રમણથી પોતે અને પરિવારને સંક્રમણથી બચી શકાય છે.

પંચમહાલ જિલ્લામાં આજે નોંધાયેલ કોરોના પોઝીટીવ સંખ્યા
ગોધરા-૪૪
હાલોલ-૪૨
કાલોલ-૦૩
શહેરા-૦૧
ગોધરા (ગ્રામ્ય)-૦૬
હાલોલ (ગ્રામ્ય)-૦૪
કાલોલ (ગ્રામ્ય)-૦૪
શહેરા (ગ્રામ્ય)-૦૨
મોરવા(હ)(ગ્રામ્ય)-૦૨
ઘોઘંબા (ગ્રામ્ય)-૦૨